

SAVE MONEY

નાણાંનો અર્થ: નાણું એ કોઈ ચોક્કસ વસ્તુ નથી. સ્થળ કાળ અને સંજોગો પ્રમાણે નાણું બદલાતું રહ્યું છે. નાણાં તરીકે ક્યારેક ઘઉં અને ડાંગર, ક્યારેક ઘેંટા અને ક્યારેક બકરાં ક્યારેક તમાકું અને સિગારેટ તો ક્યારેક સોનું અને ચાંદીનો ઉપયોગ થાય છે.

ડી.એચ.રોબર્ટસનાં શબ્દમાં કહીએ તો, “ વસ્તુઓની કિંમતની ચુકવણી કરવામાં તેમજ અન્ય દેવાની પટાવટ કરવામાં જે વ્યાપકપણે સ્વીકારવામાં આવે છે તે નાણું છે. “

જે.એલ.હેનસનનાં મતે, “ જે વસ્તુ વિનિમયનાં માધ્યમ તરીકે કાર્ય કરે અને સર્વ સ્વીકૃત હોય તે નાણું છે.”

શીલાબેન: પપ્પુ બેટા નીચે આવ આપણે હોમવર્ક કરવાનું છે.

પપ્પુ: હા, મમ્મી આવું છું.

શીલાબેન: તારી સ્કુલબેગ પણ લેતો આવજે .

(પપ્પુ સ્કુલબેગ લખવે છે.)

શીલાબેન: આ શું ? તારી બેગ ફાટી ગઈ. ચેન પણ તુટી ગઈ થોડા દિવસ પહેલાજ તો લાવ્યા છીએ. બેટા સાચવીને વાપરવી પડે ને. આ શું ? તારાં પુસ્તકો – નોટબુક પણ ફાટીને ચીથરે હાલ થઈ ગયા છે. આ બધી વસ્તુઓ આપણે આખું વર્ષ સાચવવી પડે અને વાર્ષિક મુલ્યાંકનમાં જરૂરી બને છે. સાચવીને વાપરવાથી વધુ સમય ટકે છે. આપણાં પૈસાની પણ બચત થાય.

પપ્પુ: પણ મમ્મી અવતારના પપ્પા તો એને થોડા ઠોડા સમયે નવી નવી ચીજો અપાવે છે ? તમે તો સાચવીને જ વાપરવાનું કહો છો. ફાટી જાય તો મને પણ નવું મળે ને !

શીલાબેન: અવતારના પપ્પા તો સારી કમાણી કરે છે. ખૂબ મોટા બિઝનેસ છે. જેથી કરીને સારી સારી વસ્તુઓ અપાવે છે. આપણે રહ્યા નાના માણસો, આપણો પગાર ઓછો છે. જેથી આપણે ઓછામાંથી ઓછું બચાવીને રાખીએ તો વખત આવ્યે જરૂર પડે. આજથી જ આપણે થોડું થોડું બચાવીશું તો જ તને અને દીદીને સાડું ભણાવી શકીશું, તેમજ દીદીના લગ્ન સારી રીતે કરી શકીએ. જો દિકરા પેલી કહેવત છે ને “ ટીપે ટીપે સરોવર ભરાય ”. આપણે કોઈની દેખાદેખી કરી પૈસા કે વસ્તુનો બગાડ કરવો નહી. આપણે કોઈની દેખા દેખી કરવી નહિ.

પપ્પુ: મમ્મી દેખાદેખી એટલે શું ?

શીલાબેન: કોઈ ધનવાન માણસ ફોર વ્હીલ ગાડી ખરીદે, ઘરમાં જેટલી વ્યક્તિ હોય તેટલા ટુ વ્હીલર ખરીદે, ખાવા પીવાની વસ્તુઓ પણ વધારે પડતી લે અને પછી બગાડ કરે, ફેંકે દે. તો આપણે આવા ધનવાન માણસોની બરાબરી ન કરવી. આપણી જરૂરીયાત મુજબનીજ વસ્તુ ખરીદવી. ખોટા નાણાનો વ્યય ન કરવો.

પપ્પુ: પણ, નાણાનો વ્યય એટલે શું ?

શીલાબેન: ખોટા રસ્તે નાણાં વાપરવા એટલે નાણાંનો વ્યય.

પપ્પુ: નાણાનો વ્યય કઈ કઈ રીતે અટકાવી શકાય ?

શીલાબેન: વધારે કપડાની ખરીદી ન કરવી, કેટલીક વાર વહેનો બજાર કે મોલમાં ફરવા જાય, જો પસંદ પડી જાય એટલે તેને ખરીદી લે. આમ જરૂરીયાત ન હોય તો પણ કપડાની ખરીદી કરી નાણાંનો વ્યય કરે છે.

ઘરનું બજેટ- રસોડાનાં બજેટમાં અઠવાડિયામાં જેટલો જરૂર પડે તેટલોજ સામાન લાવવો.

- બર્થ ડે પાર્ટી કે બીજી નાની-મોટી પાર્ટીઓ ઘરમાંજ રાખવી.
- કેટલાક લોકો સ્વાસ્થ્ય તંદુરસ્તી માટે જીમમાં જાય છે. તો ઘરમાંજ જીમ શાળા બનાવવી. જેથી આવવા જવાનો ખર્ચ બચે.
- આપણી જેટલી બચત છે તેની 30% બચત કરો.
- રોજ રોજનાં દિવસ, અઠવાડિયાનો, મહિનાનો હિસાબ રાખવો.
અહીં નાના ભૂલકાની SAVE MOBEY ની વાત પૂરી થાય છે.

હવે આપણે મોટેરાં કેવી રીત પૈસા બચાવી શકીએ તેની ચર્ચા કરશું.

- ❖ જે વસ્તુની જરૂર ના હોય તેવી વસ્તુઓ વેચી દો. દા.ત. ખેડૂતને વધારે અનાજ પાક્યું હોય તો પોતાની જરૂરીયાત પુરતું રાખે અને બાકીનું વેચી દીધેલું સારું.
- ❖ કુટુંબનો વાસ્તવિક બજેટ પ્લાન તૈયાર કરવો. તે તમારા કુટુંબનાં સામાન્ય ખર્ચ પ્રમાણે તૈયાર કરો. તેને વળગી રહો અને તેનો લાભ છેલ્લે લો.
- ❖ રીટાયર્ડમેન્ટ એકાઉન્ટ ખોલાવી તેમાં બચત કરો.
- ❖ ATM થી વિડ્રોલ કરો. જેથી કરીને જરૂરીયાત મુજબનાં જ નાણાંની લેવડ દેવડ કરી શકીએ.
- ❖ લોન ન લેવી કારણકે લોનની ચુકવણીમાં ઊંચો વ્યાજદર અને દંડનું પરીણામ આવે છે.
- ❖ વ્યક્તિગત મુસાફરી ટાળી બસ, ટ્રેન, રીક્ષાનો સમુહમાં ઉપયોગ કરવો.
- ❖ કેટલીક વાર ઘડપણ સુધરી જશે એવું વિચારી ઘણી બધી પોલીસી લઇએ છીએ. જેમાં બિન જરૂરી પૈસાનું રોકાણ થાય છે. જેથી કરીને એક જ પોલીસી લેવી જોઇએ.
- ❖ એવા ક્રેડીટ કાર્ડને દૂર કરો, જેનો તમે ઉપયોગ કરતા નથી કે ક્યારેક જ કરો છો. યાદ રાખો કે તમારે તમારા ક્રેડીટ કાર્ડની વાર્ષિક ફી ચૂકવવાની જ છે. અને જો તમે ઉપયોગ કરતા નથી તો નાશ કરો.
- ❖ તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હો તો પોઇન્ટ A થી પોઇન્ટ B સુધી જવા સમુહમાં જવું.તેનાથી ગેસનો, પેટ્રોલનો, ડિઝલનો ખર્ચ બચી શકે.

પપ્પુ: મમ્મી, ખરેખર બહુ મજા પડી ! હવેથી હું પણ પૈસા બચાવીશ.

શીલાબેન: હા, હું તને એક ગલ્લો લાવી આપીશ. રોજ ગલ્લામાં થોડાથોડા પૈસા બચાવીને નાંખવા. ગલ્લો ભરાઇ જશે ત્યારે આપણે તેમાના પૈસા અસહાય લોકોને મદદ માટે આપીશું. બોલ, કેવો છે વિચાર ?

પપ્પુ: મ.....સ્ત !!!!!!!!